

Seat No.: \_\_\_\_\_

Enrolment No. \_\_\_\_\_

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**  
**DIPLOMA ENGINEERING – SEMESTER – • EXAMINATION – SUMMER-2015**

**Subject Code: 3311101**

**Date: 30 /05 /2015**

**Subject Name: Electronic Components and Practice**

**Time: 02:30 PM TO 05:00 PM**

**Total Marks: 70**

**Instructions:**

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of only simple calculator is permitted in Mathematics.
6. English version is authentic.

<b>Q.1</b>	Answer any seven out of ten.	<b>14</b>
	1. Explain Tolerance of Resistance .	
	2. Explain Temperature coefficient of Resistance .	
	3. Draw symbols of PNP and NPN transistor .	
	4. Write formula for DC output voltage of Half wave and Full wave Rectifier .	
	5. Write formula of $\alpha$ and $\beta$ Transistor .	
	6. Explain Q factor for coil.	
	7. Draw BNC connector.	
	8. Draw RJ45 connector.	
	9. Explain Operating time and Release time for switch.	
	10. Write any two applications of Relay.	
<b>Q.2</b>	(a) Explain operation of transistor as an amplifier .	<b>03</b>
	OR	
	(a) Compare Half wave and Full wave rectifier .	<b>03</b>
	(b) Explain any three specifications of switches.	<b>03</b>
	OR	
	(b) Write classification of an Inductor .	<b>03</b>
	(c) Write Advantages and Disadvantages of SMD.	<b>04</b>
	OR	
	(c) Explain Full wave rectifier with circuit diagram .	<b>04</b>
	(d) Write a short note on co-axial cable.	<b>04</b>
	OR	
	(d) Write a short note on Fuse.	<b>04</b>
<b>Q.3</b>	(a) Explain VI characteristic of PN junction diode.	<b>03</b>
	OR	

- (a) Write Advantages of Optical fiber cable. **03**
- (b) Explain construction ,working and application of General purpose Relay. **03**
- OR
- (b) Explain P-type semiconductor. **03**
- (c) Explain Capacitor Filter in detail. **04**
- OR
- (c) Draw circuit with input output waveform of CE (common emitter) transistor configuration. **04**
- (d) Write classification of Switches in Detail. **04**
- OR
- (d) Explain IC packages. **04**
- Q.4** (a) Explain Faradays law of electromagnetic induction and self inductance of coil. **03**
- OR
- (a) Write Classification of Capacitors based on dielectric used. **03**
- (b) Explain construction, working and application of LDR . **04**
- OR
- (b) Explain Air Gang capacitor in detail . **04**
- (c) Explain color coding of resistors in detail. **07**
- Q.5** (a) Explain Half wave rectifier. **04**
- (b) Derive relation between  $\alpha$  and  $\beta$  for transistor amplifier. **04**
- (c) Write difference between P semiconductor and N semiconductor. **03**
- (d) Write Advantages and disadvantages of IC. **03**

\*\*\*\*\*

## ગુજરાતી

પ્રશ્ન. ૧	<p>દશમાંથી કોઈપણ સાતના જવાબ આપો.</p> <p>૧. રેજિસ્ટ્રન્સ નું ટોલરન્સ સમજાવો .</p> <p>૨. રેજિસ્ટ્રન્સ નો ટેપ્રેચર કોએફીસીયન્ટ સમજાવો .</p> <p>૩. PNP અને NPN ટ્રાનજીસ્ટર ના પ્રતિક દોરો.</p> <p>૪. હાફવેવ અને કુલવેવ રેકટીફાયર ના ડીસી આઉટપુટ નું સુત્ર લખો .</p> <p>૫. ટ્રાનજીસ્ટર માટે α અને β ના સુત્રો લખો .</p> <p>૬. કોઈલ નો Q ફેક્ટર સમજાવો .</p> <p>૭. BNC કનેક્ટર દોરો .</p> <p>૮. RJ45 કનેક્ટર દોરો.</p> <p>૯. સ્વિચ માટે ઓપરેટીંગ સમય અને રીલીજ સમય સમજાવો .</p> <p>૧૦ રીલે ના કોઈપણ બે ઉપયોગો લખો .</p>	૧૪
પ્રશ્ન. ૨	અ ટ્રાનજીસ્ટરનું એમ્પલીફાયર તરીકે કાયે સમજાવો.	૦૩
	અથવા	
અ	હાફવેવ અને કુલવેવ રેકટીફાયરની સરખામણી કરો .	૦૩
બ	સ્વીચના કોઇ પણ ત્રણ સ્પેસીઝીકેશન સમજાવો.	૦૩
	અથવા	
બ	ઈન્ડક્ટર નું કલાસિફીકેશન લખો .	૦૩
ક	SMD ના ફાયદાઓ અને ગેરફાયદાઓ લખો .	૦૪
	અથવા	
ક	કુલવેવ રેકટીફાયર વિજપરીપથ સહિત સમજાવો .	૦૪
સ	કોએક્સીયલ કેબલ ઉપર દૂકનોંધ લખો .	૦૪
	અથવા	
સ	ફ્યુજ ઉપર દૂકનોંધ લખો .	૦૪
પ્રશ્ન. ૩	અ PN જન્કશન ડાયોડની VI કેરેક્ટીરીસ્ટીક સમજાવો .	૦૩
	અથવા	

	અ	ઓપ્ટીકલ ફાયબર કેબલ ના ફાયદાઓ લખો.	03
	બ	સામાન્ય હેતુક રીલેની રચના ,કાયે અને ઉપયોગો સમજાવો.	03
અથવા			
	બ	P- પ્રકાર નો અર્ધવાહક સમજાવો.	03
	ક	કેપેસીટર ડિલ્ટર વિગતે સમજાવો.	04
અથવા			
	ક	CE (કોમન એમીટર) ટ્રાનજીસ્ટર કન્ફીડ્યુરેશન નો વિજપરિપથ અને ઈનપુટ તેમજ આઉટપુટ વેવફોર્મ દોરો .	04
	સ	સ્વિચ નુ વંગિકરણ વિગતે લખો .	04
અથવા			
	સ	IC પેકેજ સમજાવો .	04
પ્રશ્ન. ૪	અ	ઇલેક્ટ્રો મેગનેટીક ઈન્ડક્ષન્શન માટેનો ફેરાડ નો નિયમ અને કોઈલનું સેલ્ફ ઈન્ડક્ષન્શન સમજાવો.	03
અથવા			
	અ	વાપરેલા ડાયઇલેક્ટ્રિક પ્રમાણે કેપેસીટર નુ વંગિકરણ લખો .	03
	બ	LDR ની રચના,કાયે અને ઉપયોગો સમજાવો. .	04
અથવા			
	બ	એર ગોગા કેપેસીટર વિગતે સમજાવો .	04
	ક	રેજિસ્ટ્રન્સનું કલર કોડીગ વિગતે સમજાવો .	04
પ્રશ્ન. ૫	અ	હાફવેવ રેકટીફાયર સમજાવો .	04
	બ	ટ્રાનજીસ્ટર માટે α અને β વચ્ચેનો સબંધ તારવો .	04
	ક	P અને N અર્ધવાહક વચ્ચે નો તફાવત લખો.	03
	સ	IC ના ફાયદાઓ અને ગેરફાયદાઓ લખો..	03

\*\*\*\*\*